

# સવારે યા સાંજે

# અકિલા

ન્યુઝ .કોમ

તા. 13 જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૨ શનિવાર



મુખ્ય સમાચાર

News of Friday, 12th January 2018

## સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળી ૩૪,૫૯૨ની સપાટી ઉપર

સેંસેક્સે પ્રથમવાર રેકોર્ડ ૯૩ થી સપાટી ફાસલ કરી : આઇસીઆઇસીઆઇ બેંક,ઓએનજીસી જેવા બહુચીપના નેતૃત્વમાં તેજ વચ્ચે નિફ્ટી ૧૦૬૫૦ની સપાટી કુદાવી

મુંબઇ,તા. ૧૨ : શેરબજારમાં આજે પણ તેજ જારી રહી હતી.કારોબારના અંતે સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૪૫૯૨ની ૯૩ થી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૧ની ૯૩ થી સપાટી પર બંધ રહ્યો હતો. આજે શેરબજારમાં તેજ માટે કેટલાક કારણો રહ્યા હતા. જેથી આશા દેખાઇ રહી છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં નજીવો ઉછાળો રહ્યો હોવા છતાં નવી ૯૩ થી સપાટી જોવા મળી હતી. નિફ્ટીએ ૧૦૬૫૦ની સપાટીને કુદાવી લીધી હતી. આઇસીઆઇસીઆઇ બેંક અને ઓએનજીસી જેવા બહુ ચીપ શેરમાં તેજ રહી હતી. જો કે રોકાણકારો સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા જાહેરમાં નિવેદન કરીને વાંધો ઉઠાવ્યા બાદ ચિંતાતુર રહ્યા હતા. એશિયન બજારમાં પણ ફાલમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. તેલ કિંમતોમાં સુધારો થઇ રહ્યો છે. તેલ કિંમતોમાં વધારો થતા તેની ચિંતા પણ દેખાઇ રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાપક સ્ટીમ્યુલસ પેકેજનો સંકેત આપ્યા બાદ યુરોપના દેશમાં પણ સ્થિતિ સારી જોવા મળી રહી છે. અમેરિકી કમાણીના આંકડા પણ આશા જગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસ માટે આજે નિરાશાજનક દિવસ રહેતા તેની ચર્ચા કારોબારીઓમાં પણ જોવા મળી હતી. ગઇકાલે ગુરુવારના દિવસે સેંસેક્સે ઇતિહાસમાં પ્રથમ વખત ૩૪૫૦૦ની સપાટ કુદાવી લીધી હતી. રોકાણકારો આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર કોર્પોરેટ કમાણીના આંકડાને લઇને આશાવાદી બનેલા છે. સાથે સાથે પહેલી ફેબ્રુઆરીના દિવસે જારી કરવામાં આવનાર સામાન્ય બજેટને લઇને પણ આશાવાદી બનેલા છે.ગુરુવારે કારોબારના અંતે સેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળીને ૩૪૫૦૩ની ૯૩ થી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટ ઉછળીને ૧૦૬૫૧ની સપાટી પર રહ્યો હતો. કોર્પોરેટ કમાણીના આંકડા વચ્ચે શેરબજારમાં આશા દેખાઇ રહી છે. આ સપ્તાહમાં જ ચાવીરૂપ કોર્પોરેટ કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે ફવે બજેટ પર પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે બજેટને લઇને કેટલાક લોકલક્ષી પગલાની અપેક્ષા કારોબારીઓ રાખી રહ્યા છે. ફાલમાં કોઇ જંગી રોકાણ ન કરાય તેવી વકી છે.

તેજની સાથે સાથે.....

- \* શેરબજારમાં જોરદાર તેજનું મોજુ ફેલાયું
- \* બેન્ચમાર્ક ઇન્ડેક્સ રેકોર્ડ ૯૩ થી સપાટીએ રહ્યા
- \* સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૪૫૯૨ની સપાટીએ
- \* નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળી ૧૦૬૮૧ની સપાટીએ
- \* ઇન્ડોસીસના પરિણામ જાહેર કરવામાં આવ્યા
- \* પહેલી ફેબ્રુઆરીના દિવસે જારી કરવામાં આવનાર સામાન્ય બજેટને લઇને રોકાણકારો આશાવાદી બન્યા
- \* આઇસીઆઇસીઆઇ બેંક અને ઓએનજીસી જેવા બહુચીપના નેતૃત્વમાં નિફ્ટીએ ૧૦૬૫૦ની સપાટી કુદાવી

- \* નાણામંત્રી અરુણ જેટલી બજેટમાં લોકપ્રિય પગલા જાહેર કરે તેવી પ્રબળ સંભાવના
- \* અમેરિકી કમ્પાણીના આશાસ્પદ આંકડા જારી કરાયા

(7:59 pm IST)